



પુર્ણા International School

Shree Swaminarayan Gurukul, Zundal

PERIODIC ASSIGNMENT - 3 2022-23	
Grade – 5	Subject- GUJARATI
Syllabus – CH-6,7 FROM TEXTBOOK	

The Paper will be divided into four sections.

[READING SECTION]

- 1) નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઊજવાય છે. અંબાજી માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કરવા તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે તેનો વધ થયો એટલે વિજ્યાદશમી ઊજવાય છે. નવ દિવસ સુધી ગરબા ગવાય છે. શેરીએ શેરીએ મંડપ બંધાય છે. રાત્રે સ્ત્રી, પુરુષો અને બાળકો ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબા ગાય છે. પછી માતાજીની આરતી થાય છે અને પછી પ્રસાદ વહેવાય છે.
- અ) અહિયા કયા તહેવારની વાત કરી છે?
- જ) અહિયા નવરાત્રી નાં તહેવારની વાત કરી છે.
- બ) નવરાત્રીનો તહેવાર ક્યારે શરૂ થાય છે?
- જ) નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમથી શરૂ થાય છે.
- ક) અંબાજી માતાએ કોનો વધ કર્યો હતો?
- જ) અંબાજી માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો.
- ડ) નવરાત્રીમાં મંડપ ક્યાં ક્યાં બંધાય છે?
- જ) નવરાત્રીમાં મંડપ શેરીએ શેરીએ બંધાય છે.
- ઈ) આરતી પછી શું વહેવવામાં આવે છે?
- જ) આરતી પછી પ્રસાદ વહેવવામાં આવે છે

2) અમદાવાદ એક ઐતિહાસિક શહેર છે. અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સાબરમતી નદીને કિનારે વસાવ્યું હતું પણ હાલ સાબરમતી નદી શહેરની વચ્ચેથી વહે છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અમદાવાદનાં રસ્તાઓ પહોળા અને પાકા છે. અમદાવાદમાં અનેક પોળો અને શેરીઓ આવેલી છે. સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે. અમદાવાદમાં બે સ્ટેડિયમ પણ છે. અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા વાહનવ્યવહારની છે. તે માટે ઘણી જગ્યાએ ફ્લાયઓવર તથા અંડરપાસ પણ તૈયાર કરવામાં આવ્યા છે .

પ્રશ્નો 1) અહિંયા ક્યાં શહેરની વાત કરવામાં આવી છે ?

જ) અહિંયા અમદાવાદ શહેરની વાત કરવામાં આવી છે

2) અમદાવાદ શહેર ક્યાં બાદશાહે વસાવ્યું ?

જ) અમદાવાદ શહેર અહમદશાહ બાદશાહે વસાવ્યું.

3) અમદાવાદનાં રસ્તાઓ કેવા છે ?

જ) અમદાવાદનાં રસ્તાઓ પહોળા અને પાકા છે

4) સાબરમતી આશ્રમ કઈ નદીનાં કિનારે આવેલો છે?

જ) સાબરમતી આશ્રમ સાબરમતી નદીનાં કિનારે આવેલો છે

5) વાહનવ્યવહારની સમસ્યા હળવી કરવાં માટે શું તૈયાર કરવામાં આવ્યું છે?

જ) વાહનવ્યવહારની સમસ્યા હળવી કરવાં માટે અમદાવાદમાં ઘણી જગ્યાએ ફ્લાયઓવર તથા અંડરપાસ પણ તૈયાર કરવામાં આવ્યા છે .

[WRITING SECTION]

નીચેનો ફકરો વાંચી ફરીથી સારા અક્ષરે લખો (ગમે તે આવી શકે છે)

[GRAMMAR SECTION]

પ્રશ્ન 3 (અ) કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો

૧) તમે સવારે કે આવશો ? [એટલે , કે]

૨) સુકેતુ સાઇકલ પરથી પડી જતા ખબ ઇજા તોપણ તે રડ્યો નહીં [અને ,તોપણ]

૩) મારી પાસે એક સાઇકલ અને એક બાઈક છે . [અથવા ,અને]

૪) તેની મમ્મી ધરમા નથી તેથી તે રડે છે . [અથવા ,તેથી]

૫) તમે વાતો કરો પણ ધીમેથી બોલો . [છતાં ,પણ]

૬) હનુમાનને **મોટા** થવા માટે પોતાના જમણા હાથનો અંગુઠો પકડ્યો .(નાના,મોટા)

૭) **ટચલી** આંગળી પકડી હનુમાન નાના થતા . (વચલી ,ટચલી)

૮) હનુમાન રાવણના સભાગૃહમાં રામના **રામદૂત** તરીકે ઉપસ્થિત હતા .(રામદૂત ,સેનાનાયક)

૯) લંકાની નગરી **સોને** મઢેલી હતી .(આરસે ,સોને)

૧૦) રાવણે **દસ** મસ્તક હતા (વીસ,દસ)

(બ) બંધ બેસતા જોડક જોડો

અ

બ

૧) હનુમાન

(ક) અશોકવન

૨) સીતા

(ખ) દસમસ્તક ,વીસહાથ

૩) રાવણ

(ગ) સોનેમઢેલી

૪) લકા

(ઘ) સંદેશાવાહક

(ચ) અયોધ્યા

(ક) નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપો

૧) ખેદાન મેદાન કરવું - બગાડી નાખવું

૨) લાલ ચોળ થઈ જવું - ખુબ જ ગુસ્સે થવું

૩) નાસ ભાગ કરવી - ભયથી ભાગી જવું

૪) મરક મરક હસવું - મંદ હાસ્ય કરવું

૫) જીદ કરવી - હઠ કરવી

ડ) નીચેના વિધાનો કદરૂપું બતકડું પાઠનાંઆધારે ગોઠવી ક્રમ લખો

૧) બાકીના બચ્ચાં મશ્કરી કરવા લાગ્યા .૨

૨) અચાનક વાવાઝોડું આવ્યું . ૩

૩) બતકી એ ચાર ઈંડા મુક્યા. ૧

૪) તે એક રાજહંસ હતો . ૫

૫) બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું . ૪

[LITERATURE SECTION]

પ્રશ્ન : નીચેના પ્રશ્નોના જવાબ લખો.

૧) હનુમાન ના માતા પિતાનું નામ લખો .

જ) હનુમાન ના માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું .

૨) માતા એ હનુમાન ને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું ?

જ) માતા એ હનુમાન ને જંગલમાંથી થોડા પાકાં ફળ લઈ આવવા કહ્યું .

૩) હનુમાન વાનર નો શો અર્થ સમજાવે છે ?

જ) હનુમાન 'વા ' એટલે થોડું અને 'નર' એટલે મનુષ્ય એવો અર્થ સમજાવે છે .

૪) રામને સંદેશો કોણ આપે છે ?

જ) રામને સંદેશો હનુમાનજી આપે છે.

૫) સીતા ક્યાં છે ?

જ) સીતા અશોકવનમાં છે .

૬) બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મુક્યા ?

જ) બતકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મુક્યા.

૭) બતકી બધા બચ્ચાંને શું શીખવવા લઈ ગઈ ?

જ) બતકી બધા બચ્ચાંને તરતા શીખવવા લઈ ગઈ.

૮) "કદરૂપું બતક " ખરેખર શું હતો ?

જ) "કદરૂપું બતક " ખરેખર રાજહંસ હતો .

૯) પાંચમુ ઈંડુ કોનું હતું ?

જ) પાંચમુ ઈંડુ રાજહંસ નું હતું .

